


## ગુરુ દક્ષિણા



આજથી ૯૦-૭૦ વરસ પહેલાની વાત છે. ચંદનપુર નામનું નાનું ગામ હતું. ગામમાં દરેક જાતિ-જાતિના લોકો રહેતા હતા. શાળાઓ તે સમયે ગામડે ગામડે ખૂલી ન હતી. આ ગામમાં ગિરજાશંકર શાસ્ત્રી રહેતા હતા. આમ તો ગિરજાશંકર નો વ્યવસાય કોઈ ખાસ હતો નહિ. યજમાનવૃત્તિથી ઘર ચાલતું. ગામમાં મહાદેવજીનું મોટું મંદિર અને આ મંદિરની પૂજા ગિરજાશંકર કરતા. ઉંમરમાં સાઈઠ વર્ષ વટાવી ચૂકયા હતા પણ ગામના બાળકોના શિક્ષણ માટે તેઓ સમર્પિત હતા. ગામનાં છોકરાંઓને મંદિરની પરસાળમાં મફત ભણાવે. છોકરાં ૪-૫ કિલોમીટર દૂર ની પ્રાથમિક શાળામાં ભણવા જતાં. તે જમાનામાં ટ્યુશન પ્રથા હતી નહિ બલ્કે ગુરુ શિષ્યના પ્રેમાળ સંબંધો હતા. ગિરજાશંકર દિવસના કુરસદના સમયે ગામનાં બાળકોને નિયમિત ભણાવતા હતા, બદલામાં ગામલોકો પાસેથી કંઈ જ માગતા ન હતા.

એક દિવસ સરપંચે ગામ ભેગું કરીને કહ્યું, “ભાઈઓ, ગિરજાશંકર શાસ્ત્રી આપણાં છોકરાંને મફત ભણાવે છે તો આપણે પણ તેમનો વિચાર કરવો જોઈએ. છોકરું એક વરસ આખું ભણે અને આપણે કંઈ ન આપીએ તે કેમ ચાલે ? ઓછામાં ઓછી વરસના અંતે ગુરુદક્ષિણા તો આપવી જ જોઈએ ને ? ” બધા સંમત થયા. બસ ત્યારથી દર વર્ષે ગિરજાશંકર ગુરુના ચરણોમાં પોતપોતાની શક્તિ મુજબ ગુરુદક્ષિણા મૂકતા. જો કે ગિરજાશંકરે ધણી ના પાડેલી પણ ગામ લોકોના નિર્ણય આગળ તેમને ઝૂકવું પડેલું. જીતું હજુ ચોથા ધોરણમાં ભણતો હતો. ધરેથી તેને નાસ્તા માટે થોડા ધણા પૈસા મા-બાપ આપતાં. જીતું પણ ગિરજાશંકર ગુરુને ત્યાં ભણવા જતો. અભ્યાસમાં તે સૌથી આગળ હતો. શાળામાં ફંમેશ તેનો પહેલો નંબર રહેતો. જીતુને વાપરવા મળતા પૈસા તે પોતાના માટીના ગલ્લામાં લેગા કરતો. તે ધોરણ પાંચમાં આવ્યો ત્યારે તેના પિતાજીનું મૃત્યુ થયું. હવે ધરમાં કમાનાર કોઈ રહ્યું નહિ. એકનો એક દિકરો એટલે મા ને તો વહાલો હોય જ પણ

જુતુના સુંદર સ્વભાવને કારણે તે આખાય ચંદનપુરમાં માનીતો હતો. નાનપણમાં તેને મોટી આપત્તિ આવી પડી. ગિરજાશંકર ગુરુ પણ બહુ દુઃખી થઈ ગયા હતા. પણ જુતુએ મનમાં નક્કી કરેલું કે ગમે તે થાય મારે તો બસ આગળ ભાગવું જ છે ગુરુએ પણ જુતુને જયાં સુધી ભણે ત્યાં સુધી ભણવવાનું બીડું ઝડપું હતું અને એમ વરસો પસાર થયાં.

પિતાના મૃત્યુ પછી જુતુ ગુરુને કોઈ જ ગુરુ દક્ષિણા આપી શકયો ન હતો. છતાં ગુરુ ગિરજાશંકર તેના અભ્યાસમાં બધી જ રીતે મદદ કરતા રહ્યા. જુતુ હવે કોલેજમાં ગયો. હોશિયાર હોવાથી તે ડોક્ટરી લાઇનમાં ગયો. સમય જતાં કયાં વાર લાગે છે ? જોત જોતામાં તો જુતુ ચંદનપુર ગામનો સૌથી પહેલો ડોક્ટર બન્યો. ચંદનપુરની બાજુના મોટા ગામમાં તેણે દવાખાનું ખોલ્યું. ચંદનપુરના બધા જ દર્દીઓની તો તે મફત દવા કરતો પણ અઠવાડિયામાં શનિવારે કોઈપણ દર્દી જાય તો તે મફત સેવા આપતો.

એક દિવસ ચંદનપુરના પોસ્ટમેને આવીને જુતુને વાત કરી કે આપણા ગુરુજી બિમાર છે. ઉંમરના કારણે શાસ્ત્રીજી લગભગ મરણ પથારીએ પડ્યા હતા. તરત જ જુતુને જબકારો થયો. ગુરુજી બિમાર હોયતો તરત જ જવું પડે, પોતાની દવાની પેટી અને એક થેલી લઈ તે પહોંચ્યો ચંદનપુર. ગિરજાશંકર શાસ્ત્રીની આસપાસ જુના નવા વિદ્યાર્થીઓ વીટળાઈ ગયા હતા. જુતુ આવ્યો. બધાએ જગ્યા કરી આપી. ગુરુજીની નાડી જોઈ હુદયના ધબકારા માપ્યા અને આંખો બંધ કરી. તેના કપાળ પર પરસેવો રેલાતો હતો. તે સમજુ ગયો હતો કે ગુરુજી હવે વધુ સમય નથી. તેણે ગુરુજીના ચરણ સ્પર્શ કર્યા. હુદયને મજબૂત કર્યું. તેમના માથા પાસે બેઠો. કપાળે હાથ અડાડ્યો. ગુરુજીની આંખો ખુલ્લી. જુતુને જોયો. હર્ષનાં આંસુ આવ્યાં. બે હાથ ઊચા કરી આશીર્વાદ આપ્યા. બધા વિદ્યાર્થીઓની આંખો ભરાઈ આવી. જુતુ બોલ્યો, “ગુરુજી, હું ઘણો મોડો પડ્યો છું. આપે મને ભણાવી-ગણાવી ડોક્ટર બનાવ્યો પણ તમારે કામ ન આવ્યો. ઘણા વરસો સુધી આપે ભણાવ્યો અને ત્યારે મારી પાસે કશું ન હતું- આજે આ આપના ચરણમાં મૂકું છું.” પેલી થેલીમાંથી માટીનો ગલ્લો કાઢી ગુરુ ચરણે મૂક્યો. “આ મારી ગુરુદક્ષિણા છે. આપ સ્વીકારી લો.” એટલું બોલતાં જુતુ રડી પડ્યો. ગુરુની આંખો ભીંજાઈ. બધા વિદ્યાર્થી રડવા લાગ્યા. ગુરુએ માટીનો ગલ્લો હાથમાં સ્વીકાર્યો. જુતુએ તે ગલ્લામાં રોજ કંઈ ને કંઈ ગુરુદક્ષિણા ભેગી કરી હતી. ડોક્ટર બન્યા પછી જુતુને જે આવક થતી તેમાંથી ૧૦% રકમ ગલ્લામાં નાંખતો. આમ ઘણી મોટી રકમ ગલ્લામાં ભેગી થઈ હતી. ગલ્લો ગિરજાશંકર શાસ્ત્રીએ હાથમાં પકડવાનો પ્રયત્ન કર્યો પણ ભારે હોવાથી તરત જ જુતુને આપી દીધો. તેમણે કહ્યું, “જુતુ, તું તો આ બધા વિદ્યાર્થીઓ માટે આદર્શ છે. તું ખૂબ ભખ્યો અને ડોક્ટર બન્યો એ જ મારી ગુરુદક્ષિણા છે.” જુતુએ કહ્યું, “ગુરુજી, આ રકમ આપની જ છે આપ કહેશો તે રીતે તેનો ઉપયોગ કરીશું.” ગુરુએ કહ્યું, “બેટા, ગામમાં પુસ્તકાલય બનાવજો.” ગુરુજીનું વાક્ય પૂરું થયું. બધા સામે એક વખત જોઈ લીધું અને હંમેશ માટે આંખો બંધ કરી દીધી.

વિદ્યાર્થીઓ, વાલીઓ અરે, આખું ગામ રડયું. પછીની બધી કિયાઓ પણ પૂર્ણ થઈ.  
અને ત્યાર પછીના વર્ષે જ ચંદનપુર ગામમાં ખૂબ જ સુંદર અને પુસ્તકોથી ભરપુર એક  
પુસ્તકાલય બન્યું. નામ હતું “ગિરજાશંકર શાસ્ત્રી પુસ્તકાલય. ” ગિરજાશંકર ગુરુને સાચો  
શિષ્ય મળ્યો અને જીતુને સાચા ગુરુ.